

3rd July, 2021

To,
The Manager (Listing),
The BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001
Script Code: 532683

To,
The Manager (Listing),
National Stock Exchange of India Limited
"Exchange Plaza", C-1, Block – G,
Bandra-Kurla Complex, Bandra (E)
Mumbai – 400 051
Script Code: AIAENG

Dear Sir/Madam,

Sub: Submission of Newspaper Advertisement as per Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 consisting of notice given to shareholders as per the Investor Education & Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of newspaper advertisement published for Notice to Shareholders in respect of transfer of equity shares of the Company to Investor Education and Protection Fund (IEPF) in accordance with Rule 6 of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 and amendments thereof.

Please take the same on record and acknowledge the receipt of the same.

Yours faithfully,

For AIA Engineering Limited

S. N. Jetheliya

Company Secretary

Encl: 1. Notice published in The Economic Times, English dated 03.07.2021

2. Notice published in Financial Express, Gujarati dated 03.07.2021

382410

CIN: L29259GJ1991PLC015182

An ISO 9001 Certified Company

Corporate Office: 11-12, Sigma Corporates, B/h. HOF Showroom, Off S. G. Highway, Sindhu Bhavan Road, Bodakdev, Ahmedabad 380 054. Gujarat, INDIA. Ph.: +91-79-66047800 Fax: +91-79-66047848

Registered Office: 115, G.V.M.M. Estate, Odhav Road, Odhav, Ahmedabad - 382410. Gujarat, INDIA. Ph.: +91-79-22901078 Fax: +91-79-22901077 | www.aiaengineering.com, E-mail: ric@aiaengineering.com





is in a No progress is likely till

Rainfall vesterday



FORECAST

Delhi saw some respite from the heat yesterday,

receiving showers

Northeastern states will continue to receive heavy rainfall

Yesterday's hottest Mumbai is likely to see a wet weekend Yesterday's hot place was Gang in Rajasthan at 44.5°C

Exports Grow in June; Trade Gap at \$9.4b

Outbound shipments rise 47.34% on-year to \$32.46 b driven by engg goods, petroleum products, gems & jewellery

New Delhi: Driven by engineering goods, petroleum products, and gems and iewellery, India's merchandise exports in June rose in the product of the product o

20. oods imports in June increased 33% to \$41.86 billion, led by per-98:33% to \$41.86 billion, led by per-roleum, pearls, precious & semi-precious stones, and electronics, leaving a trade deficit of \$9.4 bil-lion compared to a trade surplus of \$0.71 billion in June 2020.

Trade Winds Apr 195.7 May 69.35

June*

TRADE DEFICIT

trade surplus of

Trade deficit stood at

\$9.4 b compared to a

\$0.71 b in June 2020

June trade deficit widens on-year

Imports during April-

vear-ago period

June 2021 were \$126.1b.

up from \$60.65 b in the

"India is thus a net importer in June 2021," the commerce and industry said in a statement.

Trade deficit in New was at an Irrade deficit in New York of the Marchard School of Marchard

Wholesale. **Retail Trade Brought in MSME Fold**

Our Bureau

New Delhi: In a move that will benefit over 2 crore retail and wholesale traders, the government has included retail and wholesale trades as medium and wholesale trades as medium and wholesale trades as medium and wholesale trade will also get benefit of priority solidations, retail and wholesale trade will also get benefit of priority solidations of the solidation of the sol

Office Supply Jumps 75% During Jan-Jun in 7 Cities Despite Covid-19

PTI

New Delhi: New supply of office spaces increased 75% year-on-year to 25.11 million sqft oss seven ma-cities during jor cities during the first six months of this ca-lendar year despi-te the Covid-19 pan demic, as realty firms remain bul-lish on revival in workspace de-mand, according to JLL India. New office space suppl-

o JLL India. New
office space supply
stood at 14.38 millions of fduring January-June 2020
across seven cities
— Delhi-NCR,
Mumbai, Bengaluru, Pune, Kolkata,
Hyderabad and
Chennai.

Chennai.
"...completions
during H1 2021 were recorded at 25.11 during H1 2021 were recorded at 25.11
million sqft, an inrease of 7.5% yeand 7.5% yethat developers are confident of a
strong revival in
office leasing activity once business
are confident of a
strong revival in
office leasing activity once business
ted," said JLL India Head (Office
Leasing Advisory)
Rehul Arora.
In Chemnan fresh

No Change in Ecomm FDI Policy: Goyal

Min says policy crystal clear since it was announced but certain clarifications would be issued shortly

New Delhi: Commerce and indus-try minister Piyush Goyal on Fritry minister Piyush Goyal on Friday said the government will not change the current policy of foreign direct investment in the ecommerce sector as it has been "crystal clear" since it was announced but said that certain clarifications would be issued shortly.

neurostal clear" since it was announced the remainder of the commence of the c





the highest-ever level of exports during April-June quarter at \$55 billion on account of healthy growth in sectors, including engineering, rice, oil meals and marine products, and said that the country can clock \$1.5 trillion of goods and services exports in the next few years. India's merchandise exports the services are presented in the country of the country of

next few seas exports in the lard few semantials exports. India's men in the first quarter of FY21and \$290.6 billion in the entire fiscal.

"Exports during April-June period are the highest ever merchantial and the control of India. The record flevel was achieved as centre and states are working together, water sector working together, vater sector working together, the first power of the control of India. The condition of the state highest sector working together, the state of the sector working together, the sector working together, the sector working together, the sector working together, the sector work is the sector work of the sector work in the sector work is the sector work in the sector work in the sector work is the sector work in the sector work in the sector work is the sector work in the sector

BSES Discoms Can Now Exit PPAs with NTPC's Dadri Plant

Told to Approach power min: CERC order likely to trigger many such petitions

Our Bureau

Our Bureau

New Delhi: Power regulator Central Electricity Regulatory Commission (CFRC) has allowed to the contral Electricity Regulatory Commission (CFRC) has allowed to the contral Electricity Regulatory and the contral to the co

The old PPAs contact.



March guidelines give choice to power distribution companies to continue or exit PPAs that have completed their 25-year term and completed their 25-year term and allowing the generators to sell electricity in any mode. The old PPAs consist mostly of those between discoms and po-

Coal Plants to be Half of NTPC Portfolio by 2032

New Delhi: Country's largest power company NTPC Ltd will reduce coal-based generation to half of its capacity in a decade, while power under a publicly-listed arm. The company plans to list its green subsidiary NTPC Reneways to the company plans to list its green subsidiary NTPC Reneways to the company plans to list its present to make the company plans to list its more companied to the companied of the compani

AIA ENGINEERING LIMITED (CIN::L29259GJ1991PLC015182)

Regd, Office::115, 6WMM Estate, Odhav Road, Odhav, Ahmedabad - 382 410

Website::www.alaengineering.com::E-mail::ric@alaengineering.com
Phone::079:22901078, Fax::079:22901077

NOTICE TO SHAREHOLDERS
TRANSFER OF EQUITY SHARES TO INVESTOR EDUCATION
& PROTECTION FUND (IEPF)

Notice is hereby published pursuant to the provisions of the investor Education and Protection Hund Authority (Accounting, Audit, Iransfer and Returnal Return (1888, 2016 °C the IBFR Rules*) notified by the Ministry of Coopcrate Artials effectes, 2016 °C the September, 2016 as arrended from time to time. The IBFR Rules is nonegot other matters, contain provisions for transfer of all shares in respect of which dividend has not been paid or calmed by the sharersolders for seven consecutive years in the name of hereoff becaution Production Found (1887 °C).

consecure years in the name of Investor Education Production Fund ("IEPF"). Accordingly, Shares of those Shareholders who have not caliend or encashed their dividend for seven consecutive years from 2013 14 will be transferred to IEPF individual communication has been sent to those shareholders whose shares are individual communication has been sent to those shareholders whose shares are company has also upleaded the details of such shareholders and their shares of Company has also upleaded the details of such shareholders and their shares the fortunation to IEPF into the webbate. In the Virginia was engangering confinances/IEPF prior the shareholders can verify the details of unencashed dividends and the shares liable to be transferred to IEPF from the webbate.

Rules.

The Shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEFF, may note that the Company would be issuing duplicate share certificately in lied of the original share certificately she led by them for the purpose of the transfer of shares to IEFT as per the IEFT Rules and upon such issue, the original share certificately share restant repostered in their name will stand noting shares in demander label from the shares are failed to be transferred to IEFF. may note that the Company shall transfer the shares after following procedure prescribed in Rules. The Shareholders may further note that declared upolaced by the Company on its twesters should be regarded and shall be deemed adequate notice in respect of issue of shares to IEFP compant for the VEFF fuels.

Company for the purpose or transact of states to ILPT pursuant to the ILPT reues. The Shareholders are requested to claim unpaid dividend on or before ITP Metebor. 2021 from the Company or the Registrar, falling which the Company will be compelled to transfer the shares to the IFPF without any further notice, with a view to comply with the requirements set out in the IEPF Rules.

to Conjpy with die regulements set out nie EEP naues. For any clarification on the matter, please contact the Company's Registrar and Transfer Agent: Link Intime India Private Limited, 506-506, Amarinath Business Centre-1, (ARC.), Resides Gala Reismess Centre, Ren's T Xavier's College, (Rf C.G. Road, Ellisobridge Ahmedabad 380 006 Tol. 072-26465179: Email: legis-franses/@informthuc.co.in, velsites: www.linkintime.co.in.

e.co.in. For AIA Engineering Limited Sd/-

S. N. Jethe

cial said.

He said the equity component would be around Rs 50,000 crore and the balance would be met through long-term loans, deep turnes and bonds. The said so plans to top the properties and bonds. The properties are said bonds to the properties and bonds to properties and bonds. The properties are said bonds to properties and bonds to properties are said bonds. The properties are properties are said bonds to properties are properties and bonds. The properties are properties are properties and bonds to properties are properties and bonds. The properties are properties are properties are properties and bonds. The properties are properties are properties are properties are properties and bonds. The properties are properties are properties are properties and the total capacity is expected to reach the total capacity is expected to reach the total capacity is able on a bright and bonds. The properties are properties are properties are properties are properties. The properties are properties are properties and the UN High-level planned by the company till 1982 with the company till 1982 with the properties are properties and the properties are properties. The properties are properties and the properties are properties and the properties are properties. The properties are properties are properties are properties and the properties are properties. The properties are properties are properties and the properties are properties and the properties are properties. The properties are properties are properties and the properties are properties are properties. The properties are properties are properties and the properties are properties and the properties are properties. The properties are properties are properties are properties and the properties are properties are properties. The properties are properties are properties are properties are properties are properties are properties. The properties are pr

was signed a year ago.
NTPC- the first

signed last year. The government is considering offering viability gap funding options for offshore wind energy projects, sthey are called the state of the constant of the constant of the constant of the 30 Gw offshore wind capacity by 2002.

E-TENDER NOTICE NO : 16

Date: 02/07/2021 olapur City Development Corporation Limited (SCDCL) is invite e-tender from eligible bidders prough e-tenderring portal for Appointment of Agency to Supply of FRP manhole, under Smart

Name of Work	EMD Amount (Rs)	Completion Period	Cost of Blank Tender Form (Rs)
Appointment of Agency to Supply of FRP manhole, under Smart Cities Mission.	Rs.2,20,530/-	12 Month	Rs.2360/- (Rupees Two Thousand Three Hundred Sixty Only Including 18% GST)

Online Pre bid Meeting is at 11.30 PM of 09/07/2021 thorough Google Meet / Zoom App at Solapur City Development Corporation Limited, Saat Rasta, Solapur.

- Bid Submission date up to 03:00 PM of 27/07/2021.

•The Technical Bid Opening date is 03.00 PM of 29/07/2021.
•The tender can be downloaded from www.mahatenders.gov.in

The bidders should quote exclusive of GST.

All rights of acceptance and rejection of tender is reserved by SCDCL.

Tender ID : 2021_SMC_701142_1

SD/- Chief Executive Officer Solapur City Development Corporation Limited

E TENDER NOTICE SOLAPUR CITY DEVELOPMENT CORPORATION LIMITED PETENDER NOTICE NO: 14
Solapur City Development Corporation Limited (SCDCL) is invite e-tender from eligible bidders through e-bendering portal for Appointment of Construct Integrated Command and Control Center for Solapur Municipal Corporation, under Smart Cities Mission.

Name of Work	Estimated Cost	EMD Amount	Initial Security	Completion	Cost of Blank
	(Rs)	(Rs)	Deposit (Rs)	Period	Tender Form (Rs)
Appointment of Construct Integrated Command and Control Center for Solapur Municipal Corporation, under Smart Cities Mission	(Rupees Four Crores Fifty Nine Lakhs Ninety Two		Rs. 4,60,000/-	08 Month	Rs. 3,540/- (Rupees Three Thousand Five Hundred Forty Only including 18% GST)

Tender release date is 10:00 am on 03/07/2021

Online Pre bid Meeting is at 04.00 PM of 09/07/2021 thorough Google Meet / Zoom App at Solapur City Development Corporation Limited, Saat Rasta, Solapur.

Bid Submission date up to 03:00 PM of 28/07/2021
The Technical Bid Opening date is 04,00 PM of 29/

-Bio Suomission date up to 0:500 PM of 22/07/2021.

The Technical Bid Opening date is 04.00 PM of 29/07/2021.

The tender can be downloaded from www.mahatenders.gov.in

The bidders should quote exclusive of GST.

All rights of acceptance and rejection of tender is reserved by

MderJD : 2021 SMC 701005 1

SD/- Chief Executive Officer Solapur City Development Corporation Limited

NOTICE | Folio No. | Name of the shareholder(s) | Certificate | Distinctive Max | No of Not | Not Numer & Address of Shareholder(s) SHNTABEN KARSANBHAI ANKURBEN K KUMBHAI Name And Registered Office address of Company: Arman Financial Services Limited 502-503, Sakar-III Building, Opposite Old High Cour Off Ashram Road, Ahmedabad 3800 14

"Expression of Interest to submit Resolution
Plan for Sical Logistics Limited
Sical Limited
Sical Logistics Limited
Sical Limited
Sical Logistics Limited
Sical Limited
Sical Limited
Sical Logistics Limited
Sical Limite

GMR INFRA SERVICES PRIVATE LIMITED

Reg, off; 7³¹ FLOOR, NAMAN CENTRE, PLOT NO. C31, G BLOCK BANDRA – KURLA COMPLEX, BANDRA (EAST), MUMBAI – 400051, MAHARASHTRA CIN: U45201MH2016PLC281405 (Contact No. +91 22 42028000, Email id: suruchi.bamrara@emindslegal.com)

BEFORE THE CENTRAL GOVERNMENT

(REGIONAL DIRECTOR, WESTERN REGION)

In the matter of sub-section (4) of Section 13 of Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014
And
In the matter of GMR INFRA SERVICES PRIVATE LIMITED having its registered office at "7" FLOOR, NAMAN CENTRE, PLOT NO. C31, G BLOCK BANDRA – KURLA COMPLEX,
BANDRA (EAST), MUMBAI – 400051, MAHARASHTRA"

Notice is hereby given to the General Public that the company proposes to make application to the Central Government, power delegated to Regional Director, under Section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the extra ordinary general meeting held on June 4, 2021 to enable the company to change its Registered Office from "The State of MAHARASHTRA" to "The State of HARYANA".

Any person whose interest is likely to be affected by the proposed change of the registered office of the company may deliver either on the MCA-21 portal (www.mca.gov.in) by filing investor compilaint form or cause to be delivered or send by registered post of his/her objections supported by an affidavit stating the nature of his/her interest and grounds of opposition to the Regional Director, Western Region, Shr Floor, 100, Everest Building, Netaji Subhash Road, Marine Dr, Mumbai – 400002, Maharashtra within fourteen days of the date of publication of this notice with a copy to the Petitioner Company at its registered office at the address mentioned below:

"7" FLOOR, NAMAN CENTRE, PLOT NO. C31, G BLOCK BANDRA – KURLA COMPLEX, BANDRA (EAST), MUMBAI – 400051, MAHARASHTRA" For and on behalf of GMR Infra Services Private Limited

Ankit Kumar Barolia Date: July 2, 2021 Place: New Delhi Director DIN - 07729279 GMR GROUP-GIS/1/PREM ASSOCIATES

એઆઈએ એન્જિનિયરીંગ લીમીટેડ

કોર્પોરેટ આઇડેબ્ટિફિકેશન નં. : એલરલ્સ્પજીજેનલ્લ્વપીએલસી૦૧૫૧૮૨ ૨જીસ્ટર્ડ ઓ ફીસ : ૧૧૫, જી વી એમ એમ એસ્ટેટ, ઓઢવ રોડ, ઓઢવ, અમદાવાદ–૩૮૨૪૧૦ વેબસાઇટ : www.aiaengineering.com, ઇ-મેઇલ : ric@aiaengineering.com

શેરદારકોને નોટીસ ઈક્વિટી શેરોને ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ)માં તબદીલ કરવા

આથી આ નોટીસ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઑથોરિટી (એકાઉન્ટીંગ ઑડીટ, ટ્રાન્સફર એન્ડ રીફંડ) રૂલ્સ, ૨૦૧૬ (આઈઈપીએફ રૂલ્સ) કે જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા તા. ૭મી સપ્ટેમ્બર, ૨૦૧૬ (તેમજ સમચાંતરે તેમાં થયેલ સુધારા મુજબ) થી અમલ કરવામાં આવેલ છે, તેના અનુસંધાનમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.

આઈઈપીએફ રૂલ્સ, તથા અન્ય બાબતોના સંદર્ભમાં દર્શાવેલ જોગવાઈ મુજબ જેશેરધારકોએ સતતસાત વર્ષ સુધી ડિવિડન્ડની રકમ જમા લીધી નથી કે તેના ઉપર દાવો કરેલ નથી તેઓના બધા જ શેરો ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ખાતે તબદીલ કરવાના રહેશે. આ મુજબ જેશેર ધારકો એ ૨૦૧૩–૧૪ થી સતત સાત વર્ષ સુધી ડિવિડન્ડની રકમ જમા લીધી નથી તેઓના બધા શેરો આઈઈપીએફ ખાતે તબદીલ કરવામાં આવશે. કંપની દ્વારા તે દરેક શેરધારકો કે જેમના શેરોને, આ રૂલ્સ અનુસાર આઈઈપીએફ ખાતે તબદીલ કરવાના છે તેઓને અલગથી વ્યક્તિગત રીતે તેમના ઉપલબ્ધ સરનામે પ્રત્રવ્યવહાર મોકલવામાં આવેલ છે. કંપની દ્વારા તે દરેક શેરધારકો અને તેમના શેરોની વિગતો પણ કંપનીની વેબસાઈટ http://www.aiaengineering.com/finances/IEPF.php. ઉપર અપલોડ કરેલ છે. શેરધારકો તેમની ડિવિડન્ડની જમા લીધેલ ના હોય તે રકમ અને આઈઈપીએ ફ ખાતે તબદીલ થઈ રહેલા શેર અંગેની વિગતોની ચકાસણી કરી શકે છે.

શેરધારકોને વિનંતી સાથે જણાવવાનું કે ડિવિડન્ડની જમા લીદોલ ના હોય તે રકમ અને આઈઈપીએફ્ ખાતે તબદીલ થઈ ગયેલા શેર અને શેરો ઉપરના બધા જ લાભો જો પરત મેળવવા માંગતા હોય તો તેઓ આઈઈપીએફ ઑથોરિટી પાસેથી આઈઈપીએફ રૂલ્સમાં જ્યાવેલ ૫૬૬તિ અનુસરીને ૫૨ત મેળવી શકે છે.

જે શેરધારકો તેમના શેર સર્ટિફિકેટ સ્વરૂપે ધરાવે છે અને જેમના શેરો આઈઈપીએફ ખાતે તબદીલ કરવાને પાત્ર છે તેઓ આ નોંધ લઈ લે કે આઈઈપીએફ રૂલ્સ અનુસાર કંપની આ શેરોને આઈઈપીએફ ખાતામાં તબદીલ કરવાના ઉદેશથી અસલ શેર સર્ટિફિકેટની સામે ડુપ્લીકેટ શેર સર્ટિફિકેટ જારી કરશે અને આ શેર જારી થવાથી અમલ શેર સર્ટિફિકેટ જે તેમના નામે નોંધાયેલ છે તે સ્વયં ૨૬ થશે અને તે ૨૬બાતલ માની લેવામાં આવશે. વધમાં. વે શેરદારકોને શેર ડિમેટ ફોર્મમાં હોય અને જેમના શેરોને આઈઈપીએ ફ ખાતે તબદીલ કરવાને પાત્ર છે તેઓ આ નોંધ લઇ લે કે આઇઇપીએફ રૂલ્સ અનુસાર કંપની આ શેરોને આઇઇપીએફ ખાતામાં તબદીલ કરશે. શેરધારકોને વધુમાં જણાવવાનું કે કંપનીની વેબસાઈટ ઉપર આ બાબતે જે વિગતો અપલોડ કરેલ છે તે આઈઈપીએફ રૂલ્સ અનુસાર કંપની આ શેરોને આઈઈપીએફ ખાતામાં તબદીલ કરવાના ઉદ્દેશથી ડુપ્લીકેટ શેર સર્ટિફિકેટ જારી કરવા માટેની નોટીસ માની લેવામાં આવશે.

શેરધારોકને વિનંતી કરવામાં આવે છે તેઓએ જમા લીધેલ ના હોય તે ડિવિડન્ડની રકમ માટે તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં કે તે પહેલા કંપની અથવા રજીરટ્રારને દાવો કરે, જો તેમાં નિષ્કળ રહેશે તો આગળ કોઈ પણ નોટીસ આપ્યા લગર તેમના શેરોને આઈઈપીએક ઉલ્સમ જ્ણાવ્યા મુજબ જરૂરી કાયદાકીય જોગવાઈઓની પૂર્વતા માટે કંપની દ્વારા આઈઈપીએફમાં

ઉપરોક્ત વિગત વિશેની વધુ માહિતી માટે કંપનીના રજીરટ્રાર અને શેર ટ્રાન્સફર એજેન્ટનો રાંપર્ક કરવા વિનંતી : લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ, ૫૦૬–૫૦૮, અમરનાથ બિઝનેસ સેન્ટર-૧, (એબીસી-૧), ગાલા બિઝનેસ સેન્ટરની પાછળ, ઝેવીચર્સ કોલેજની નજીક, ઓફ સી જી રોડ, એલિસબ્રિજ, અમદાવાદ–૩૮૦ ૦૦૬. ફોન : ૦૭૯–૨૬૪૬૫૧૭૯ ઇ–મેઇલ : iepf.shares@linkintime.co.in, તેબસાઇટ : www.linkintime.co.in

એઆઈએ એન્જિનિયિરીંગ લીમીટેડ વતી, તારીખ : ૨ જુલાઈ, ૨૦૨૧ એસ.એન.જેથલીયા કંપની સેક્રેટરી સ્થળ : અમદાવાદ

KIRLOSKAR FERROUS INDUSTRIES LIMITED

A Kirlosker Group Company Registered Office: 13, Lexmanreo Kirlosker Road, Khadki, Pune - 411 003, Maharashtra (India). CIN: L27IOIPNI991PLC063223



Enriching Lives

NOTICE OF ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOKS CLOSURE DATE NOTICE OF ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOKS CLOSURE DATE
Notice is hereby given that the 30th Annual General Meeting ('AGM') of the Members
of Kirloskar Ferrous Industries Limited ('the Company') will be held on
Tuesday, 27 July 2021 at 11.30 a.m. (IST) through Video Conferencing ('VC') or Other
Audio Visual Means ('OAM') facility, in compliance with provisions of the Companies
Act, 2013 ('the Act') and rules thereof, as amended, read with the General Circular No. 17/2020 dated 3 April 2020, the General Circular No. 17/2020 dated 3 April 2020, the General Circular No. 17/2020 dated 3 April 2020, the General Circular No. 17/2020 dated 3 April 2020, the General Circular No. 20/2021 dated 13 January 2021 issued by the Ministry of Corporate Affairs
(collectively referred to as 'MCA Circulars') and the SEBI (Listing Obligations and
Disclosure Requirements) Regulations, 2015, as amended, read with the
SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12 May 2020 and
No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15 January 2021 issued by the SEBI
(collectively referred to as 'SEBI Circulars').
Notice is further given that nursuant to provisions of Section 91 of the Companies

Notice is further given that, pursuant to provisions of Section 91 of the Compan Act, 2013; rules thereof and the SEBI (Listing Obligations and Discloss Requirements) Regulations, 2015; the Register of Members and the Share Trans Books of the Company will remain closed from Sunday, 18 July 2t to Tuesday, 27 July 2021 (both days inclusive) for the purpose of declaration of Fi Dividend at the AGM.

In compliance with the MCA Circulars and the SEBI Circulars; the Notice of AGM and In compliance with the MLA cliculairs and the SEBI Circulairs, the Noticle of AgM and the Annual Report for the financial year 2020-2021 have been sent in electronic mode only to all those Members, whose email addresses are registered with the Company or the Registrar and Share Transfer Agent or their respective Depository Participants. The Notice of AGM and the Annual Report for the financial year 2020-2021 are available at the website of the Company viz. www.kirloskarferrous.com and the website of BSE Limited viz www.bseindia.com.

Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014; Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and as amended; the Company is pleased to provide to the Members the facility to exercise amended; the Company is piessed to provide to the refined as a reality to con-their right to vote by electronic means through the National Securities Depositor Limited ('NSDL') on all items of businesses as set out in the Notice of AGM The Members may cast their votes using an electronic voting system from a place other than the venue of the AGM ('Remote e-voting') or by e-voting at the AGM The Cut-off date has been fixed as Tuesday, 20 July 2021 for determining e ligibility of Members to cast the vote by remote e-voting or by e-voting at the AGM.

Pursuant to Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and as amended from time to time; the Members are provided with following

- The dispatch of the Notice of AGM alongwith the Annual Report has been completed by electronic mode on 2 July 2021.
- 2. The remote e-voting period commences on Saturday, 24 July 2021 at 9:00 a.m. (IST) and ends on Mondey, 26 July 2021 at 5:00 p.m. (IST).
- Remote e-voting shall not be allowed beyond 5:00 p.m. (IST) on Monday, 26 July 2021.
- on Monday, 25 July 2021.

 4. A Member, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut Off date shall be entitled to avail the facility of remote e-voting or the e-voting at the AGM.

 5. Any person, who acquires shares of the Company after dispatch of the Notice of AGM and becomes Member of the Company and holds shares as of the Cut Off date may obtain login ID and password by sending a request to evoting@nsdl.co.in However, if a person is already registered with NSDL for remote e-voting, then existing User ID and password can be used to cast the vote. If you forgot your password, you can reset your password by using "Forgot User Details / Password" or "Physical User Reset Password" option available on www.evoting.nsdl.com A Member can also use the OTP (One Time Password) based login to cast the vote on the e-voting system of NSDL

 6. The Members are also informed that:
- 6. The Members are also informed that:
- a) The Members attending the AGM through VC / OAVM facility, who have not cast the votes by means of remote e-voting, shall be able to cast the vote through e-voting at the AGM.
- b) The Members, who have cast their votes by remote e-voting, may also attend the AGM through VC / OAVM facility, but shall not be entitled to cast their votes again at the AGM.
- c) The procedure for electronic voting and attending the AGM through VC / OAVM facility have been provided in the Notice of AGM. The Notice of AGM is available at the websites of the Company www.kirloskarferrous.com; BSE Limited viz. www.bseindia.com and NSDL viz. www.evoting.nsdl.com
- mmm.useingia.com and NSDL VIZ. WMW.evoting.nsdl.com

 d) In case of any queries, the Members may refer the Frequently Asked Questions
 (FAQs) for Members and e-voting user manual for Members available at the
 Downloads section of www.evoting.nsdl.com or call on toll free number
 1800 1020 990 and 1800 02 244 30 or contact Ms. Sarita Mote, Assistant
 Manager, National Securities Depository Limited, Trade World, A Wing,
 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai
 400013 at the Email 1D evoting@nsdl.co.in who will address the grievances
 relating to electronic voting. The Members may also write to the Company
 Secretary at email 1D kfilinvestor@kirloskar.com or to the Registered Office
 Address.

Place: Pune Date: 2 July 2021 Mayuresh Gharpure Company Secretary · Telephone: (020) 66084645 · Fax: (020) 25813208 · E-mail: kfilinvestor@kirioskar.com · Website: www.kirioskarferrous.com

Mark bearing word "Kirloskar" in any form as a suffix or prefix is owned by 'Kirloskar Proprietary Limited' and 'Kirloskar Ferrous Industries Limited' is the Permitted User.

SBFC

એસબીએક્સી કાચનાન્સ પ્રાઇવેટ લીમીટેડ

(જુની સ્મોલ બિઝનેસ ફિનક્રેડીટ ઈન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ) રજીસ્ટર્ડ ઓફીસ: યુનિટ નં.૧૦૩, પહેલો માળ , સી એન્ડ બી સ્ક્વેર, સંગમ કોમ્પલેક્ષ, ગામ ચકલા, અંદોરી-કુર્લા રોડ, અંદોરી (પુર્વ), મુંબઇ-૪૦૦૦૫૯

કબજા નોટીસ (સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૨) મુજબ)

એસબીએફ્સી ફાયબાન્સ પ્રાઇવેટ લીમીટેડના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી કલમ ૧૩ (૧૨) હેઠળ મળતી સત્તાઓનો ઉપયોગ કરીને નીચે જ્યાવેલ દેવાદારો/સહ–દેવાદારોને માંગણા નોટીર

જારી કરી જ્યાવેલ ગોટીસ મળ્યાની તારીખેલી ૬૦ દિવસની અંદર નોટીસમાં જ્યાવેલ ૨કમ ચુકવવા જ્યાવ્યું હતું. દેવાદાર/સહ–દેવાદારો રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર/સહ–દેવાદારોને નોટીસ આપવામાં આવે છે કે જાહેર જનતાને જાહ કરવામાં આવે છે કે ગીસે સહી કરળારે જણાવેલ ગિયમોગા ગિયમ ૮ સાથે વંચાતી જણાવેલ એક્ટગી કલમ ૧૩ (૪) હેઠળ તે/તેણીગે મળતી સત્તાગ ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકતનો કબજો નીચે જણાવેલ તારીખોએ લઇ લીધો છે.

ખાસ કરીને દેવાદાર/સહ–દેવાદારો અને જાહેર જનતાને આથી મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેન કોઇપણ સોદો એસબીએફ્સી ફાયનાન્સ પ્રાઇવેટ લીમીટેડના ચાર્જને આદિાન રહેશે.

દેવાદારોનું નામ અને સરનામું અને માંગણા નોટીસની તારીખ	મિલકત(તો)ની વિગત અને કબજાની તારીખ	કબજા નોટીસમાં માંગણાની સ્ક્રમ (રૂપિયામાં)
૧. અપ્સા ઇન્ટરનેશનલ, ૨. અનિલ	પ્લોટ નં. ૧૩૪ (રેવન્યુ રેકોર્ડ ૭-૧૨ મુજબ બ્લોક નં. ૧૪૬/બી/૧૩૪,	રૂા. ૬૧,૮૩,૨૩૦/–
બાસુદેવ વિશ્વકર્મા અને ૩. પ્રેમિલા	ક્ષેત્રફળ ૯૧.૩૮ ચો.મી.), ક્ષેત્રફળ અંદાજીત ૯૧.૩૮ ચો.મી. પ્લોટ એરિયા	(રૂપિયા એક્સઠ લાખ
વિજય વિશ્વકર્મા, તમામનું સરનામું :	તેમજરોડ અને સીઓપીની જમીનમાં ન વહેંચાયેલ હિસ્સો ક્ષેત્રફળ ૩૧.૧૯	ત્યાંસી હજાર બસ્સો ત્રીસ
પ્લોટ નં. ૧૩૪, મા કૂપા રેસિડેન્સી,	ચો.મી., ગ્રાઉન્ડ ફ્લોટ્રે પહેલો માળ, તેના પરનું બાંધકામ ક્ષેત્ર ફળ ૭૧.૨૫	પુરા)
દેલવાડા રોડ, ડિંડોલી, સુરત-૩૯૪૧૫૦	ચો.મી.,માઁ કૃપા તરીકે જાણીતી સોસાચટીમાં, રેવન્યુ સર્વે નં.૧૦૧,બ્લોક	૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧
માંગણા નોટીસની તારીખ: ૧૬ ફેબુઆરી, ૨૦૨૧	નં. ૧૪૩, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૬૯ (ગોડાદરા–ડિડોળી), ફાઇનલ પ્લોટ નં. ૧૩૧, જ્યીન ક્ષેત્રફળ ૨૬, ૧૪૯.૦૦ શો.મી., ગામ– ડિડોળી, તાલુકો– સુરત શહેર, જિલો–સુરત ખાતેની મિલકતના તમામ ૯ક, ટાઇટલ અને હિત. કળજાની તારીખ: ૨૬ જૂન, ૨૦૨૧	મુજબ

સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયમર્ચાદા અંગે એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮)ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે અદિાકૃત અદિાકાર્ર એસબીએફ્સી ફાચનાન્સ પ્રાહેવેટ લીમીટેડ

Oriental Aromatics Std.

CIN: L17299MH1972PLC285731

Regd. Office: 133, Jehangir Building, 2nd Floor, M.G. Road, Mumbai-400001 Tel No:91-22-43214000 Fax:91-22-43214099 Email: cs@orientalaromatics.com Web Site www.orientalaromatics.com

NOTICE

The notice is published pursuant to the applicable provisions of the Companies Act 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended ("the Rules").

The Rules, inter alia contain provisions for transfer of share(s), in the name of Investor Education and Protection Fund (IEPF) Suspense Account in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more.

Notice is further given that in accordance with the provisions of the Rules, individual notices have already been sent to respective shareholders at their latest available address in the Company records, inter alia, providing the details of shares being transferred to IEPF Suspense Account, for taking appropriate action(s). The Company has uploaded the full details of such shareholders whose shares are liable for transfer to IEPF on the website of the Company. i.e. www.orientalaromatics.com

The concerned shareholders are requested to claim the unpaid/unclaimed dividend amount(s) on or before 10th October, 2021, failing which the shares will get transferred to IEPF Suspense account. Please note that no claim shall lie against the company in respect of unclaimed dividend amount and equity shares transferred to IEPE

Shareholders may note that both the unclaimed dividend amount and the equity share(s) transferred to the IEPF including all the benefits accruing on such shares, if any, can be claimed back by them from IEPF Authority, after following the procedure prescribed by the Rules. The Rules and the application Form (Form IEPF-5) as prescribed are available at IEPF website i.e. www.iepf.gov.in

For any further information/clarification, shareholders are requested to write to or contact our RTA, Link Intime India Private Limited, Unit: Oriental Aromatics Limited, C-101, 247 Park, LBS Marg, Vikhroli (West), Mumbai - 400083.Tel: 022-49186270 Fax: 022-49186060, <u>Email-rnt.helpdesk@linkintime.co.in</u> or can also contact the Nodal Officer- Ms Kiranpreet Gill at the Regd Office address of the Company.

For Oriental Aromatics Ltd.

Date: 02-07-2021 Place: Mumbai

તે રીખ : 03.0૭.૨૦૨૧

Kiranpreet Gill Company Secretary

|રીલાયન્સ એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની લીમીટેડ reli∧nce

કોર્પોરેટ ઓફીસ : રીલાચન્સ સેન્ટર, છઠ્ઠો માળ, નોર્થ વિંગ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે

પડખ, શાતાક્રુઝ–ઇસ્ટ, મુબઇ–૪૦૦ ૦૫૫

સિક્ચોર્ડ એસેટના વેચાણની નોટીસ (નિચમ ૮(૬) સાથે વંચાતો નિચમ ૬(૨) જુઓ)

સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ(એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઇઓ સાથે વંસાતા સિક્ચોરીટાઇ) ગ્રેન અને ટીકન્સ્ટ્કગ્રન ઓફ કાચનાન્સિયલ એસેટા ાને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલક્તના વેસાણ માટે ઇ–હરાજી વેસાણ નોટીસ નાથી ખાસ કરીને દેવાદાર(રો) અને જામીનદાર(રો) અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર/જંગમ મિલકતો સિક્ચોર્ડ કેડિટર ીરો/હાયપોથીકેટેડ કરવામાં આવી હતી જેનો ભૌતિક કળજો શિક્ચોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે.

r દેવીગેર હાઉદોંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન વીમીટેડે તારીખ **૨૯.૦૩.૨૦૧૯** નો એસાઇનમેન્ટ એગ્રીમેન્ટ દ્વારા આરએઆરસી ૦૫૯ (આરએસડીએફ્સીએન ોચએવ) ટરટના ટરટી રીલાચન્સ એસેટ રીકન્સ્ટક્શન કંપની લીમીટેડ (આરએઆરસી)ની તરકેણમાં નીચે જ્યાવેલ સિક્ચોરીટીઝ સાથે તેના હકો, ટાઇટલ, અ ડીતો સહીત તમારા લોન એકાઉન્ટોની નાણાંકિય મિલકતો (લેણાં સોંપ્યા છે. જેગાહેલ સોંપણીના આદ્યારે અમે તમારા સિક્યોર્ડ ફ્રેલ્ડિટર બનીએ છીએ અને સમય કરારેલક .કી રકમ વસુલવા કાનુની હકદાર છીએ.

રિણામે, બીરો સહી કરનાર રીલાચજા એરોટ રીકન્સ્ટ્રક્શન કંપની લીમીટેડના અધિકૃત અધિકારી આથી તમને 30 દિવસીય નોટીસ આપે છે કે નીચે જ્યાવેલ મોર્ગેલ્ત મુંલકતા એટલે કે "જ્યાં છે". "જે છે", અને "જેમ છે" ના દોરણે ઇ-ઠરાજાના માર્ગે નીરો મઠી કરનાર દારા નીરો જણાતેલ દેવાદારો/મોર્ગેજરો પાસેથી આરએઆસ્સી ૦૫ મારએચડીએફ્સીએલ એચએલ) ટૂસ્ટના ટૂસ્ટી તરીકે રીલાયન્સ એસેટ રીકન્સ્ટુક્શન કંપની લીમીટેકની માંગણ નોટીસમાં જણાવેલ બાકી રકમ સડત વ્યાજ અ ર્યની વસુવાત માટે **૧૩.૦૮.૨૦૨૧** ના રોજ વેચવામાં આવશે. રીઝર્વ કિંમત અને અનેંસ્ટ મની ક્યોઝીટ (ઇએમડી) નીરો મુજબ છે.

ગીરો મિલકતની વિગત

લોટ વં.	દેવાદા રોનું નામ, મિલકતની વિગતો, માંગણા નોટીસ અને કબજાની તારીખ	અનામત સ્ક્રમ	ઇએમડી
۹.	નિલેશભાઇ વિનુભાઇ વેકરીયા, વિનુ ભાણાભાઇ વેકરીયા અને કાંતાબેન વિનુભાઇ વેકરીયા, બધાનું સરનામું : ફ્લેટ નં. ૪૦૨, ચોચો માળ, સાંઇરેસિકેન્સી, બ્લોક નં. ૯૪, મોજે ગામ-સાચણ, તાલુકો-ઓલપાડ, સુરત, ગુજરાત-૩૯૪૧૩૦ મિલકત : ફ્લેટ નં. ૪૦૨, ચોચો માળ, ક્ષેત્રફળ ૧૨૫૦,૦૦ ચો.ફુટ, સુપર બિલ્ટ અપ એરિચા, ૧૧૨૭.૮૨ ચો. ફુટ એટલે કે ૧૦૪.૭૮ ચો.મી. બિલ્ટ અપ એરિચા તેમજ ૨૨.૨૧ ચો.મી. ''સાઇરેસીકેન્સી'' ની જમીનમાં ન વહેંચાયેલ હિસ્સો, બ્લોક નં. ૯૪ પૈકી, પ્લોટ નં. ૮ ચી ૧૨, મોજે ગામ સચાણ, તાલુકો ઓલપાડ, સુરત, ગુજરાત ખાતે આવેલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. માંગણા નોટીસ : રૂા. ૧૩,૪૮,૯૮૧.૧૨/– (રૂપિયા તેર લાખ અડતાલીસ હજાર નવસો એક્ચાંસી અને બાર પૈસા પૂરા) ૧૦.૦૨.૨૦૨૦ મુજબ વતા ચડલ વ્યાજ અને ખર્ચ.		રૂા. ૧,૬૨,૫૦૦/-
q .	શજેશ અલગુરામ મૌર્ચા અને મમતા સર્જશ મૌર્ચા બક્ષેનું સરનામું : દૃપ, સાંઇળાળા સોસાયટી, ળામરોલી રોડ, પાંડેસરા સુરત સિટી, ફતેહનગર, સુરત, ગુજરાત-૩૯૪૨૨૦, અહીં પ્રશ: પ્લોટ નં. ૪૦૦, સર્વે નં. ૨૦૦/૧, ૨૯૩, બ્લોકનં, ૨૮૯/એ, રદ્યુનાથ રેસિડેન્સી, મોલેનગામ મુલાડ તાલુકો ઉતપાડ, સુરત, ગુજરાત, અહીં પ્રશ: પ્લોટ નં. ૫૦૨–૫૦૩, ત્રીજો માળ, સોનાવ ઇન્ડસ્ટ્રીયલ ૨, બામરોલી રોડ, ઉદ્યાના, સુરત, ગુજરાત-૩૯૪૨૧૦ મિલકલ: પ્લોટ નં. ૪૦, સર્વે નં. ૨૦૦/૧, ૨૯૩, બ્લોક નં. ૨૮૯/એ, રદ્યુનાથ રેસીડેન્સી, મોલે ગામ મુલાડ, તાલુકો ઓલપાડ, સુરત, ગુજરાત (સેગફળ અંદાઇલ ૯૨.૧૯ શો.શાર્ડ) ના તમામ ભાગ અને હિસ્સા. માંગણા નોટીસ: સ. ૧૩,૧૮,૮૨૩.૪/– (રૂપિયા તેર લાખ અઢાર હજાર આઠસો ત્રૈવીસ અને યુમ્મોત્તેર પૈસા પુરા) ૧૦.૦૨.૨૦૨૦ મુજબ તતા સડત વ્યાજ અને ખર્ચ.	ą ι.	₹I. ૧,૨૫,૯૩૫. ૧/−

માગણા નાટાસ : રૂા. ૧૩,૧૮,૮૨૩.૭૪/– ૧૦.૦૨.૨૦૨૦ મુજબ વત્તા રાકત વ્યાજઅને	રૂપિયા તરે લાખ અઢાર હેજાર આઠસા જ્રવાસ અને ચુમ્માતર પસા પુરા) ખર્ચ. કબજાની તારીખ: ૦૫.૦૩.૨૦૨૧
મિલકતનાં નિરિક્ષણની તારીખ	: ૧૧/૦૮/૨૦૨૧ નાં રોજ બપોરે ૧૧.૦૦ થી ૦૨.૦૦
બીડ સુપરત કરવાની છેલી તારીખ	: ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ બપોરે ૩.૦૦ સુધી
ઇ–હરાજીની તારીખ	: ૧૩/૦૮/૨૦૨૧ નાં રોજ પ્રતિદીઠ ૫ મીનિટનાં વધારા સહિત સવારે ૧૦.૦૦ થી બપોરે ૧૨.૦૦ સુઇ
વેચાણની શરતો અને નિયમો:	

મિલકત રીઝર્વ કિમંતથી ઓછી કિમંતે વેચવામાં આવશે નહી અને વેચાણ સિક્ચોર્ડ ક્રેકીટર તરીકે આરએઆરસીની મંજુરીને આદિન રહેશે.

- ઇ-ઓ ક્શન મેં. ઇ-મ્રોક્યુરમેન્ટ ટેકનોલોજી લિ. (ઇટીએલ) મારફત ઓનલાઇન કરવામાં આવશે. ઇ-ઓ ક્શનમાં ભાગ લેતાં પહેલા, રસ ધરાવનાર બીડરો માન્ય ઇ-મેઇલ આઇડી મેળવવાનો રહેશે અને તેમનાં નામો પોર્ટલ http://reliancearc.auctiontiger.net પ રજીસ્ટર કરાવવાનો રહેશે અને તેમના યુઝર આઇડી અને પાસવર્ડ મે. ઇ-પ્રોક્યુરમેન્ટ ટેકનોલોજી લિ (ઇટીએલ) પાસેથી મેળવવાનાં રહેશે
- ભાવી બીડ્રોને મેં, ઇ-પ્રોક્ચરમેન્ટ ટેકનોલોજ઼ લિ., ઓક્શન ટાઇગર, અમદાવાદ દારા ઇ-ઓક્શનની ઓનવાઇન તાલીમ પ્રાપ્ય રઠેશે. (સંપર્કકર્તા વ્યક્તિઓ: ધ ા પ્રસાદ મો.+∈૧૭૬ – ૬૮૧૩૬૮૦૩ , છમેછલ: ramprasad@auctiontiger.net/arc@auctiontiger.net/ અથવા support@auctiontiger.net) (મો.૯૨૬૫૫૬૨૮૨૧, ૯૨૬૫૫૬૨૮૧૮, ઓક્રીસ:૦૭૯ ૬૮૧૩ ૬૮૩૭/૮૦)
- અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઇએમડી) આરટી (પ્રુએસ)એનઇએ ફરી ફંડ ટ્રાન્સ ફરનાં કરન્ટ એકાઉન્ટ નં. ૬૭૪૨૫૫૭૦૮૮, બેંકનું નામ, ઇન્ડિયન બેંક, શાખા: શાન્તાક્રુઝ લેસ્ટ શાખા, મુબંઇ, ૪૦૦૦૫૪ લાભાર્શ્ચીનું નામ: આરએઆરસી– ૦૫૯ (આરએસડીએ ફ્સીએલ એચએલ)દ્ગસ્ટ, આઇએફએસસી કોડ: IDIB000S010 પર જ
- કરવાની રહેશે. નોંધ લેવી કે ચેક/ડિમાન્ડ ડ્રાફ્ટ ઇએમડી તરીકે સ્વીકાર્ચ રહેશે નહી. રિઝર્લ કિંમતથી ઓછી કિંમતી બીડો અને/ અથેલા ઇએમડી રકમ સિલાયની બીડો સ્વીકાર્ય રહેશે નહી. બીડરો તેમની અન્ય બીડ રકમોમાં લોટ દીઠ રૂા. ૫,૦૦૦/–
- સફળ બીકરને સફળ બીકર તરીકેની ઘોષણા પછી તરત જબીકની રકમ/બેચાણ કિમંતનાં ર૫ ટકા ચુકવવાનાં રહેશે (અનેંસ્ટ મની સહીત) ચુકવવાની રહેશે. સફ બીકરે બાકીની ૭૫ ટકા બીક/બેચાણની રકમ સફળ બીકર તરીકે ઘોષીત થયાની તારીખથી ૧૫ દિવસની અંદર જ્યા કરવાની રહેશે. જો સફળ બીડર ઉપર જણાવેલ વેચાણ કિમંત જમાં કરાવવામાં નિષ્ફળ જશે તો, ઇએમડી સહીત તમામ જમા રકમ જાા કરવામાં આવશે.

અસફળ બીડરોની ઇએમડી રકમ ઇ ઓક્શન વેસાય પ્રક્રિયાની સમાપ્તિ પછી સાત દિવસની અંદર વ્યાજ વગર પરત કરવામાં આવશે.

- અધિકૃત અધિકારી દ્વારા અપાચેલ વિગતો તેમની શ્રેષ્ઠ જાણકારી, માન્ચતાઓ અને અહેવાલો અનુસાર છે. અધિકૃત અધિકારી કોઈપણ ભુવ, ખામીચુક્ત નિવેદ કે કસૂર માટે જ્વાબદાર રહેશે નહી. નીસે સહી કરનાર અધિકૃત અધિકારી કોઇપણ પુર્વ નોટિસ અથવા કોઇપણ કારણો જણાવ્યા વગર કોઇપણ બીડનો સ્વીકાર/અસ્વીકાર કરવાનો અથવા વેચા
- મોકુક/મુલતવી/ રદ કરવાની અને કોઇપણ શરતો અને નિયમો ઘડવાનો હક અને સત્તા રહેશે. બીડરો મેલકત પર ચાર્જ/બોજા સબંધતિ પુછપરછો કરી શકે છે અને તેમી જાતને ટાઇટલ, માપન વિસ્તાર, અને મિલકતની ગુણવત્તા અંગે તેમની બીડ સુપરત કરત પહેલા પોતાની જાતે સંતોષ મેળવી શકે છે. મિલકત પર ચાર્જુસ, બોજાઓ અને અન્ય કોઇપણ બાબતો વગેરે માટે કોઇપણ પ્રકારનો દાવો ઓનલાઇન બીડ સુપર
- પ્રાપ્ત માહીતી મુજબ નીચે સહી કરનારને આ નોટીસની તારીખે મિલકતો પર કોઇ બોજા અંગે જાણકારી નથી. r. મિલકત પર કોંઇ બોજો, બાકી રકમ, વેરા, વીએટી, ટીડીએસ , જીએસટી ચાર્જ કાળુળી અથવા તે સિવાચ મિલકતળા વેચાણળી સ્ટેમ્પ ડ્યુટી/૨જીસ્ટ્રેશન ફી ફક્ત
- ખરીદારે ભોગવવાની રહેશે. કોઇપણ વધુ માહિતી માટે સંપર્ક કરવો : શ્રી વિપિન ફુમાર મીના (મો. ૯૧૩૬૯૫૭૬૮૨) સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૬(૨), ૮(૬) અને ૯(૧) હેઠળ કાનુની ૩૦ દિવસીય નોટીસ દેવાદારો/સહ-દેવાદારો/જામીનદારો/ગીરવેદારોને આથી ઉપર જ્યાવેલ રકમ, તેમજ આખર તારીખ સુધીનું વ્યાજ અને આકરિમક ખર્ચ ઇ–હરાજી પહેલ ચુકવવા જ્યાવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં ઉપર જ્યાવેલ ગીરો મિલકતનીઇ–હરાજી કરવામાં આવશે અને બાકી રકમ જો કોઇ હોય તો, વ્યાજીખર્ચ સહી

પસુલવામાં આવશે. અધિકૃત અધિકારી, રિલાયન્સ એસેટ રિકન્ટ્રક્શન કંપની લીમીટેડ

સરફેંસી એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ માંગણા નોટીસ જારી કર્યો પછી ભરપાઇ કરાચેલ સ્કમ વસુલાત/પતાવટના સમયે ચુકવવાપાત્ર બાકી સ્કમની ખાતરી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે

ૐ∆વ∀કા આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેડ

(અગાઉ એ.ચુ. હાઉસીંગ ફાચનાન્સ લીમીટેક તરીકે જાણીતી) (CIN :L65922RJ2011PLC034297)

રજી. અને કોર્યો. ઓફીસ : ૨૦૧–૨૦૨, બીજો માળ, સાઉથ એન્ડ સ્ક્વેર, માનસરોવર ઇન્ડસ્ટ્રીચલ એરિયા, જ્યપુર. ૩૦૨૦૨૦

૨૦૦૨ ના સિક્યોરીટાઇઝેશન કાયદાની કલમ ૧૩(૨) હેઠળ માંગણાં નોટીસ ોન એકાઉન્ટ એનપીએ થયા હોવાથી સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટસ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ ન

હ્લમ ૧૩(૨) હે*છ*ા અધિકૃત અધિકારી (એઓ) એ નીચેર્ના કોષ્ટકમાં આપેલ દેવાદારો ને ૬૦ દિવસીય માંગણાં નોટીસ જારી કરે છે. નોટીસ મુજબ જો દેવાદાર ૬૦ દિવસો કમ જમા નહી કરે તો, નીચે આપેલી ગીરો મિલકતો/સિક્યોર્ડ એસેટની હરાજી કરીને વસુલવામાં આવશે. દેવાદાર/જામીનદારને મોકલાયેલ માંગણા નોટીસની બજવણી થઇ શકી ન હોવાથી. નીચે આપેલ સિક્યોર્ડ મિલકતો પર માંગણા નોટીસની નકલ ચોંટાડવામાં પણ આવેલ છે. અથી તમો દેવાદારોને ૬૦ દિસની અંદર લોનની રકમ તેમતજ ચડત યાજ અને વસુલાત ખર્ચ જમા કરવા જાણ કરવામાં આવે છે, નહીતર જણાવેલ એક્ટની કેલમ ૧૩ (૪) અને ૧૪ની જોગવાઈઓ હેછળ, અધિકૃત અધિકારી નીચે આપેલ સિક્યોરીટીનો કબજો લેવા મુક્ત છે.

	લમ ૧૩(૨) હેઠળ માંગા ોટીસની તારીખ અને ૨૧	
ત્રી પ્રવિણભાઇ રૂપાભાઇ રાકોડ, શીમતી ભારતીબેન પ્રવિણભાઇ રાકોડ, જામીનદાર: શ્રી ધનશ્યામભાઇ કામેજીહિયા (A/c No.) LNSNA00617-180048708	૦૨-જુલાઇ-૨૧ રૂ. ૭૪૩૪૩૭.૪૧/- ૨૬-જુન-૨૧	સબ પ્લોટ નં. ૬ પૈકી, પ્લોટ નં. ૭૨ થી ૭૬ પૈકી, મુલયંદ રેવન્યુ સવે૪ નં. ૨૨ અને ૨૩ પૈકી, મુલયંદ, વઢવાણ, જિલો– સુરેન્દ્રનગર, ગુજરાત ખાતેની મિલક્ત. ક્ષેત્રફળ ૩૪.૯૭૫ ચો.મી.
ગ્રી મનસુખભાઇ રણછોડભાઇ પંભાળિયા, શીમતી મુક્તાબેન પંભાળીયા, શ્રી રાહુલ મનસુખભાઇ પંભાળિયા (A/c No.) LNBOT00517-180055204	૦૨-જુલાઇ-૨૧ રૂા. ૬૦૮૩૦ <i>૭ -</i> ૨૬-જુન-૨૧	પ્લોટ નં. પ, મુકામ શેરથાળી, ગામતલ, શેરથાલી, તાલુકો-બોટાદ, જિજ્ઞો બોટાદ, ગુજરાત ખાતેની મિલકત ક્ષેત્રફળ ૨૧૭.૩૭ચો.ની.
ત્રી પોપટલાલ મુનિલાલ જોપી, શીમતી ભાવનાએન સુરેશકુમાર જાની, શ્રી સુરેશકુમાર પોપટલાલ જાની (A/c No.) LNPLH02918-190080426	૦૨-જુલાઇ-૨૧ ગ્રા. ૬૨૦૭૬૨/- ૨૯-જુન-૨૧	ગ્રામ પંચાયત જડીયા મિલકત નં. ૧/૭૫, એસેસમેન્ટ સિરિયલ નં. ૭૭, ગામતળ, જડિયા, તાલુકો- ધનેરા, જિલ્લો- બનાસકાંઠ્ય, ગુજરાત ખાતેની જમીન તેમજ સ્ટ્રક્ચરના તમામ ભાગ અને હિસ્સા. ક્ષેત્રફય ૧૫૨૦ ચો.કુટ
શ્રીમ તી હિરાબેન ક્રાંતિભાઇ બારૈયા, શ્રીમતી ક્રાંતિભાઇ બારૈય (A/c No.) LNBHV02918-190083247	ા ૦૨-જુલાઇ-૨૧ રૂા. ૬૬૪૪૧૭/- ૨૯-જુન-૨૧	હાઉસ નં.૨૯૪, રેસીડેન્સીયલ પ્લોટ, ગામતળ, નવા રતનપુર, જિલ્લો ભાવનગર, ગુજરાત ખાતેની મિલકત. ક્ષેત્રફળ ૬૨.૫૧ ચો.મી .
શ્રી નિતિન કુષાર મનહરલાલ શેઠ, શ્રીમતી અલ્કાબેન નિતિનભાઇ શેઠ (A/c No.) LNSNA04018-190097980	૦૨-જુલાઇ-૨૧ રૂા. ૬૭૮ <i>૬૮૭ -</i> ૨૯-જુન-૨૧	ફ્લેટ ર્ન. બીર-૧૦૪, શક્તિ શુક્ર, સુરેન્દ્ર નગર સ્ટેશન રોડ પાસે, સુરેન્દ્ર નગર, ગુજરાત, ૩૬૩૦૦૨ ક્ષેત્રફળ ૩૧.૪૯ ચો.મી.
સ્થળ : જ્યપુર તારીખ : ૦૩.૦૭.૨૦૨૧		અધિકૃત અધિકારી આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેડ

ફોનિક્સ એઆરસી પ્રાઇવેટ લીમીટેક રજીસ્ટર્ડઓફીસ : પાંચમો માળ, ૧૫૮ દાની કોર્પોરેટ પાર્ક, સી.એસ.ટી. રોડ, કલિના, સાંતાકુઝ (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૯૮

આધી મેસર્સ ફોનિક્સ એઆરસી પ્રાઇટે લીમીટેડ(નીચે ટેબલમાં જણાવેલ ટ્રસ્ટના ટ્રસ્ટી તવીકે કાર્યરત)ના નીચે સહી કરનાર અધિકૃત અધિ કારીએ સિક્યોવીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિય એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોવીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોવીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૨૦ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયો કરીને નીચે જણાવેલ દેવાદારો, સહ-દેવાદારો, જામીનદારોને માંગણા નોટીસ જારી કરીને દેવાદારો, સહ દેવાદારો અને જામીનદારોને આ નોટીસમાં દર્શાવેલ ૨કમ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસન ર્બદર ચુકવવા જણાવ્યું હતું. જણાવેલ દેવાદારો, સહ દેવાદારો, જામીનદારો સ્કમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ હોવાથી દેવાદારો, સહ દેવાદારો, જામીનદારો અને જાહેર જનતાને નોટીસ આપવાગ આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ નિયમોના નિયમ ૮ સાથે વચાતા જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકતનો કબજો અહીં નીચે જણાવે તારીખોએ લઇ લીધો છે. ખાસ કરીને દેવાદારો, સહદેવાદારો અને જામીનદારો અને જાહેર જનતાને આવી મિલકનો સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકનો સાથેનો કોઇપણ સોદો મેસર ફોનિક્સ એઆરસી પ્રાઇવેટ લીમીટેડ (નીચે ટેબલમાં જણાવેલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્યરત) ની જણાવેલ ૨કમ તેમજ લાગતી વળગતી તારીખોથી તેના પરના ચડત વ્યાજ, કોસ્ટ અને ચાર્જને આધિન રહેશે દેવાદારો, સહ-દેવાદારો, જામીનદારો, ગીરો મિલકતની વિગત, ટ્રસ્ટનું નામ, કલમ ૧૩(૨)હેળ મોકલેલ માંગણા નોટીસ અને તે હેઠળ દાવો કરાયેલ રકમોની વિગતો નીચે

કરતાં. દેવાદાર, સહ-દેવાદારનું નામ અનેસરનામું લોનએકાઉન્ટ નંબર, લોનની રકમ લે ૧ . મેમર્સ શ્રી બાલમુકુંદ સૈટેઇન શોપ-એ, શ્રી નિલેશભાઇ ડી દેવરીસા અને શ્રી નિલેશ દેવચંદ દેવરીસા અને શ્રીમતી મમલાબેન નિલેશભાઇ પટેલ ઉર્ફે દેવરીસાની પ્રોપરાસદસ્થીપ હંપની. તમામનું સરનામું: શોપ નં. ૧ અને ૨, સાઉન્ડ કરલોટ , રમાય પોછન્ટ, દીરાભાગ સાર સ્ટલા, તરાહ્ય દોર, સુરત, ગુજરાત–3લ્પ૦૦૬, દીરાભાગ સાર સ્ટલા, તરાહ્ય દોર, સુરત, ગુજરાત–3લ્પ૦૦૬, સિક્યોરિટીની વિગતો ૧) ફોનિક્સ ટ્રસ્ટ વર્ષ ૨૦-૬ સ્કીમ સી તમામનું સરમામું: શોપ નંત અને ર, પ્રાઉન્ડ ફ્લીર, ટ્રમાય પોછન્ટ, કિરાભાગ ચાર સ્ટતા, તારાશ એક, સુરતા, ખુજરાત-૩૯૫૭, જ.()ર, અને જ.()ર, રાઉન પ્લામિંગ સ્ક્રીમ નં.ટ. અહીં પણ: ૧૯૯,વિક્રમ નગર કો-ઓપ હાઉસિંગ સોસાચટી લિમેરીડેડ, બ્રિકમ નગર પ્રાસે, એલ એસ સેડ, નવાગામ, સુરત, ખુજરાત-૩૯૫૦૬, અહીં પણ: ૧૦૯, લિક્રમ નગર સોસાઅદી બોમ્બે માર્કેટ, એલએસ રોડ, નવાગામ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૬ ભોને એકાઉન્ટ નંબર: PR00598995 & PR00605616 મેજૂર કરેલ લોનની સ્ક્રમ: રૂપ. ૮, ૧૬, ૮૬૯/- (રૂપિયા સિલ્યાસી લાખ સોળ હજાર નવાસો ઓગણપસાસ પુરા)

કુલાડવા રેલન્યુ સર્વે નં. ૨૫૩ અને ૨૫૪/૧, બંસંત ૧) ફોનિક્સ ટ્રસ્ટ વર્ષ ૨૦-૬ સ્કીમ સી બહાર રીસોર્ટ પાસે, પ્લોટ નં. ૨૦, વાંકાનેર રોડ, **૨) ૦૧.૦૩.૨૦૨૧**

ક ક્રી ચંદ્રકાંત પરસોત્તમભાઇ પરસાણા અને શ્રીમતી ભાવના ચંદ્રકાંત પરસાણા. તમામનું સરનામું, શેરી નં. બે શ્રીજી વિહાર ચોગી નિકેતાના પ્લોટ રાજકોટ, નિર્મલા કોન્વેન્ટ રોક, રાજકોટ, ગુજરાત-કર૦૦૫. અહીં પણ: પ્લોટ નં. ૨૦, કુવાડવા, બસંત બહાર રીસોર્ટ પાસે, સી.કે.જીનીંગ પાછળ, તાંકાનેર રોક, શેશનલ હાઇયે નં. ૮ળી, કુવાડવા, રાજકોટ, ગુજરાત-3૬૦૦૦૧. લોન એકાઉંકન્ટ નં. : PRO/33787 મંજુટ કરેલ લોનની કુલ ટકમ: રૂ.આ,૦૦,૦૦૦/– (રૂપિયા પિસ્તાલીસ લાખ પુરા) કુલાડવા હાઇલે રોડ, તાલુકો અને જિલો– રાજકોટ– 3) ૨૯.૦૬.૨૦૨૧ કુવાડવા હાઇવે રોડ, તાલુકો અને જિલો– રાજકોટ– 3) ૧૯.૦૬.૧૭૧૫ ૩૬૦૦૧૩ ખાતેની સ્તાવાર મિલકતના તમામ ભાગ અને હિસ્સા અને ચતુઃસીમાઃ ઉત્તરઃ પ્લોટ નં.૨૭, દક્ષિણ: રોડ, પુર્વઃ પ્લોટ નં.૧૬, પશ્ચિમ: પ્લોટ નં.૨૧ લાગુ ચડત ત્યાજ તેમજ સંપૂર્ણ વસ્તુલાત ગ્રેઝને દારુ શ્રી ચંદ્રકાંતુ પ્રસ્થોમ્યભાલ પાસ્ત્રાણા પ્રસ્થાણ પ્રસ્થાન પ્રસ્થે પ્રસ્થાન વિસ્તા ત્રીડ, પુર્વ: પ્લોટ નં.૧૯, પશ્ચિમ: પ્લોટ નં. ૨૧ લાગુ રાડા ત્યાલ તેમજ સંપુર્થ ગીરવેદાર: શ્રી ચંદ્રકાંત પરસોતમભાઇ પરસાણા સુધીના ખર્ચઝને ચાર્જસહીત

કોઇપણ પૂછપરછ માટે શ્રી રવિન્દ્ર ગોદાદરા (+૯૧ ૦૯૯૮ ૩૯૯૯૦૭૪) અને શ્રી અનુજ ભાસીન (+૯૧ ૯૭૨૬૪૧૭૨૫૦) નો સંપર્ક કરવા વિનંતી છે સ્થળ : ગુજરાત, તારીખ : ૦૩.૦૭.૨૦૨૧ અદ્યિકૃત અદ્યિકારી, ફોનિક્સ એઆરસી પ્રાઇવેટ લીમીટેક વતી (ટ્રસ્ટ વર્ષ ૧૦–૬ સ્કીમ સી)

J.B. Chemicals & Pharmaceuticals Limited

Regd. Office: Neelam Centre, 'B' Wing, 4th Floor, Hind Cycle Road, Worli, Mumbai 400 030. Corporate Office: Cnergy IT Park, Unit A2, 3rd floor, Appa Saheb Marathe Marg, Prabhadevi, Mumbai 400 025. Phone: 022 2439 5500 / 5200 Fax: 022 - 2431 5331 / 2431 5334,

CIN: L24390MH1976PLC019380,

E-mail: secretarial@jbcpl.com, website: www.jbcpl.com **NOTICE TO MEMBERS**

NOTICE is hereby given to the members of the Company that pursuant to the provisions of Section 110 of the Companies Act, 2013 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, the Company is seeking assent or dissent of the members of the Company by voting through postal ballot to (i) Employee Stock Option Scheme viz. "JBCPL Employee Stock Option Scheme 2021" (ii) grant of Options to employees of subsidiary and/or holding company under "JBCPL Employee Stock Option Scheme 2021" (iii) proposal to grant Options to Mr. Nikhil Chopra, Chief Executive Officer and Whole-time director, exceeding 1% of the issued share capital of the Company under "JBCPL Employee Stock Option Scheme 2021" (iv) withdrawal and revocation of employee stock option scheme set-up in the year 2004 (v) increase in cap of 5% on remuneration of whole-time director prescribed under section 197 of the Companies Act, 2013, to a level to cover increase in remuneration taking place due to perquisite value arising on exercise of stock options by Mr. Nikhil Chopra, all by way of special resolution, and (vi) increase in remuneration of Mr. Nikhil Chopra for financial year 2021-22, by way of ordinary resolution, in terms of the respective Resolution set out in the postal ballot notice dated June 25, 2021 ("the said Postal Ballot notice").

The Company has completed the dispatch of the said Postal Ballot notice accompanied by an explanatory

statement, postal ballot form and postage-pre-paid reply envelope (in cases of physical mailing cases) on July 2, 2021 to those members holding shares of the Company on June 11, 2021 ("cut-off date"). The voting right of the members shall be proportionate to their share of the paid-up equity share capital of the Company as on cut-off date. The right of members to receive the said Postal Ballot notice and the right to vote on the said resolutions shall be reckoned as of the cut-off date and a person who is not a member of the Company as on the cut-off date should treat the said Postal Ballot notice for information purposes only. The member(s) of the Company on the cut-off date who have not received the postal ballot form may apply to the Company and obtain

The members are requested to communicate their assent or dissent by returning duly filled in and signed posta ballot form through post or courier to reach the Scrutinizer latest by July 31, 2021. The Company also provides remote e-voting facility for facilitating voting through electronic means on the proposed Resolutions through e-voting platform of National Securities Depository Limited. The remote e-voting facility is available at https://www.evoting.nsdi.com/. Voting (postal and e-voting) has commenced on July 2, 2021 and voting (postal and e-voting) will end on July 31, 2021. Postal ballot form received from the member beyond the said date will not be valid and voting whether by post or by electronic means shall not be allowed beyond the said date The members of the Company are also hereby informed and are requested to note that:

(a) The businesses as set out in the said Postal Ballot notice can also be transacted by the members through

facility of remote e-voting (i.e. e-voting from any place). The remote e-voting facility is provided by the Company through e-voting platform of National Securities Depository Limited ("NSDL") for facilitating voting through electronic means, which is the authorized agency. The facility of casting votes by the members using remote e-voting system is provided by NSDL as per provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations The details of the process and the manner of remote e-voting has been communicated to the memb

through e-mail read with the said Postal Ballot notice

This said Postal Ballot notice is available on the website of the Company at www.jbcpl.com, on the website of NSDL at www.bseindia.com and website of NSDL at www.bseindia.com and website of National Stock Exchange of India Limited (NSE) at www.nseindia.com.

The remote e-voting has commenced on Friday, July 2, 2021 at 9 a.m. (IST) and would end on Saturday,

the remote e-voting shall not be allowed beyond the aforesaid date and time. Once the vote on resolution is cast, the member shall not be allowed to change it subsequently or cast the vote again.

During the above voting period, members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on cut-off date only shall be entitled to cast their vote through remote e-voting.

July 31, 2021 at 5.00 p.m. (IST). The e-voting module shall be disabled by NSDL for voting thereafter and

The Board of directors of the Company has appointed Mr. Ashish Bhatt, proprietor of Ashish Bhatt & Associates, Practising Company Secretary, and failing him, Mr. Amit Trivedi, proprietor of Amit K. Trivedi & Associates, Practising Company Secretary, as Scrutinizer to conduct the remote e-voting process in a fair and transparent manner. (g)

The result of the postal ballot will be declared on Monday, August 2, 2021 at 3.00 p.m. (IST) at the registered office by placing the same along with Scrutinizer's report on notice board at Company's registered office and corporate office. The same will also be placed on the Company's website www.jbcpl.com and website of NSDL www.evoting.nsdl.com and intimated to NSE and BSE and will also

be available on their website www.nseindia.com and www.bseindia.com respectively. A member who has not received the said Postal Ballot notice may write to the Company a secretarial@jbcpl.com to receive a copy of the said notice.

the members may contact Ms. Pallavi Mhatre, Manager of NSDL (at National Securities Depository Limited, Trade World, A wing, 4" Floor, Kamala Milis Compound, Lower Parel, Mumbai – 400013) or call on toll free no.: 1800 1020 990/1800 224 430, or Email: evoting@nsdl.co.in, who is responsible to address grievances, if any, and provide technological help connected with remote e-voting facility. A member having query connected with voting by postal ballot may contact Ms. Purvi Trivedi, Manage Secretarial at the above mentioned corporate office address of the Company or contact on telephone no

022-2439 5200 or by sending e-mail to secretarial@jbcpl.com. The members who hold shares in physical form or who have not registered their e-mail address with the Company or depository participant/depository need to follow the following process to register their

e-mail ID/procuring User ID and Password for remote e-voting:

In case the shares are held in physical mode, the member is requested to write to the Company at secretarial@jbcpl.com along with the copy of signed request letter mentioning the name and address, folio number, number of shares held on cut-off date, designated e-mail ID, self-attested copy of PAN card and self-attested copy of any identity proof in support of the address;

In case the shares are held in dematerialized mode, the member is requested either to write to the Company at secretarial@jbcpl.com along with the copy of signed request letter mentioning the name and address, number of shares held on cut-off date, designated e-mail ID, self-attested copy of client master or consolidated account statement, self-attested copy of PAN card and self-attested copy of any identity proof in support of the address or alternatively, the member may update e-mail address with the depository participant/depository and provide the Company updated client maste or consolidated account statement.

Alternatively shareholder/members may send a request to evoting@nsdl.co.in for procuring user in

and password for e-voting by providing above mentioned documents

The members may refer the Frequently Asked Questions (FAQs) for shareholders and e-voting user manual for shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990/1800 224 430 or send a request to Ms. Pallavi Mhatre at <a href="https://evoting.gov/evoting.

For J.B. Chemicals & Pharmaceuticals Ltd.

Company Secretary & Vice President - Compliance Membership No.: ACS-8854

Place: Mumbai